

ઈસ્લામમાં સજાની પ્રક્રિયા જરૂર છે પરંતુ સાથે માફી અને દરગુજરનો પણ હુકમ છે. બદી અને બૂરાઈ કરનારને સજા આપો પરંતુ તે સજા પાછળ પણ આ ધારણા હોવી જોઈએ કે આ સજાથી બદી કરનાર અથવા નુકશાન પહોંચાડનાર અને ગુનો કરનારની સુધારણા હોય. માટે જ્યારે સુધારણા હેતુ છે તો પછી સજા આપ્યા પહેલા આ વિચારો કે શું સજા આપવાથી આ હેતુ પ્રાપ્ત થઈ શકે છે.

ખુલાસા ખુતબા જુમ્મા સૈયદના હજુત અકદસ અમિન્ઝુલ મોમિનીન ખલીફુલ મસીહ અલ ખામિઝ

ઓયદહુલ્લાહ તાબાલા હિનસરિહિલ અભીજ, તા. ૨૨-જન્યુઆરી-૨૦૧૯, સ્થળ : મરાણ જૈતુલ ફૂતુલ-લંડન

તશહુદ તાબાઉજ અને સુરેહ ફાતેહાની તિલાવત બાદ હગુર અનાવર ઓયદહુલ્લાહ તાબાલા હિનસરિહિલ અભીજ એ ફરમાવ્યું.

ઇજાનો બદલો ઈજા પુરતો જ લેવામાં આવે પરંતુ જો સુધારાની આશાથી (અપરાધીને) માફ કરી દેવામાં આવે તો તેનો ભલો બદલો અવશ્ય અલ્લાહ પાસે છે જેશક તે ઝાલિમોને પસંદ નથી કરતો.

ઈસ્લામની શિક્ષા અનુસાર કોઈ હુકમ કરનાર નુકશાન પહોંચાડનારથી ભલે તે નાનું નુકશાન પહોંચાડનાર હોય અથવા મોટું નુકશાન પહોંચાડનાર હોય અથવા દુશ્મન હોય પ્રત્યેક સાથે એવો વ્યવહાર કરવાનું શિક્ષણ છે જે તેની સુધારણા માટે હોય. ઈસ્લામમાં સજાની પ્રક્રિયા જરૂર છે પરંતુ સાથે માફી અને દરગુજરનો પણ હુકમ છે. આ આયતમાં પણ જેવું કે આપે સાંભળ્યું એ જ હુકમ છે કે બદી અને બૂરાઈ કરનારને સજા આપો પરંતુ તે સજા પાછળ પણ આ ધારણા હોવું જોઈએ કે આ સજાથી બદી કરનાર અથવા નુકશાન કરનાર અને ગુનો કરનારની સુધારણા હોય. માટે જ્યારે સુધારણા હેતુ છે તો પછી સજા આપ્યા પહેલા આ વિચારો કે સજા આપવાથી આ હેતુ પ્રાપ્ત થઈ શકે છે જે વિચાર કરવાથી તથા આરોપીની હાલત જોયા પછી પણ આ તરફ દ્યાન ફરે છે કે આ આરોપીની સુધારણા તો માફીથી થઈ શકે છે તો પછી માફ કરીએ. જો સજા આપવાથી થાય તો સજા આપો. અને આ માફ કરવું પણ તમને અલ્લાહિતાબાલા તરફથી ભલો બદલો મળશે. અને અંતમાં કહું કે જો સજામાં છુદ પાર કરશો તો ઝાલિમોમાં ગણાશો. માટે બુનિયાદી કાયદો અને ઉસ્કો સજા અને સુધારણાનો કુરાનશરીફમાં પૈશ થયો છે આપણા વ્યક્તિત્વાત જીવનના મામલાઓ પર પણ હાવી છે અને હુક્મતી મામલાઓમાં પણ બલ્કે આંતરરાષ્ટ્રીય મામલાઓમાં સામાજિક સુધારણા માટે પણ આ આધાર છે. કોઈ આરોપીને સજા આપવાનું અસલ હેતુ જેવું કે મેં જણાવ્યું સુધારણા છે તથા નૈતિક ભલાઈ છે.

ઈસ્લામ કહે છે કે ફક્ત સજા પર જોર ન આપો બલ્કે સુધારણા પર જોર આપો જો તમે સમજો કે માફીથી સુધાર થશે તો માફ કરી દો જો સ્થિતિ અને ઘટના એ કહે છે કે સજા આપવાથી સુધાર થશે તો સજા આપો. પરંતુ સજામાં પણ આ વાતનો ખાસ ખ્યાલ રાખવો પડશે કે સજા ગુના પ્રમાણે હોય જો ગુનાથી અધિક સજા છે તો આ જુલ્મ અને અત્યારચાર અલ્લાહિતાબાલા પસંદ નથી કરતો.

ઈસ્લામમાં પહેલા ધર્મોની જેમ ઓછુંથતું નથી તેના સર્વ-શ્રેષ્ઠ નમૂનાઓ આપણાને આંહગરતા (સ.અ.વ.) ના જીવનમાં જોવા મળે છે જ્યારે આપે જોયું કે આરોપીનો સુધાર થઈ ગયો છે તો પોતાના મોટા દુશ્મનોને પણ માફ કરી દીધા. આપ સ.અ.વ. પર, આપની સંતાનો પર, આપના સાહાબાઓ પર કચા કચા જુલ્મો નથી થયા. પરંતુ જ્યારે દુશ્મને માફી માંગી

અને ખુદા અને તેના રસૂલના હુકમ પ્રમાણે જીવન ગુજરવાનો વાયદો કર્યો તો આપ સ.અ.વ. એ બધું ભૂતીને માફ કરી દીધા હદ્દીસમાં આવે છે કે આંહગરત (સ.અ.વ.) ની સાહેબગાઢી હગરત મૈનગ પર મક્કાથી હિજરત સમયે એક ગ્રાલિમ વ્યક્તિ હજાર જિન અસવદચે ભાલાથી હુમલો કર્યો તે સમયે ગર્ભવતી હતી તે હુમલાથી આપને ઘા પણ આવ્યા અને આપનો ગર્ભ પણ નાટ થઈ ગયો અંતે આ ઘા આપના માટે જીવન ગુમાવવા જેવું સામિત થયું. આ આરોપમાં તે વ્યક્તિને કઠલ કરવાનો ફેસલો થયો. પરંતુ આપ સ.અ.વ. નું માફ કરવું એટલું વ્યાપક છે કે જ્યારે તે પોતાના અત્યાચારો અને ગુનાહોનો એકરાર કરતાં માફી માંગવા લાગ્યો તો આંહગરત સ.અ.વ. એ પોતાની સાહેબગારીના હત્યારાને પણ માફ કરી દીધો અને ફરમાવ્યું કે જા હજાર તારા પર અલ્લાહનો અહેસાન છે કે તેણે તને ઈસ્લામ કબૂલ કરવાની તોફીક આપી અને સાચી તોબા કરવાની તોફીક આપી.

તેવી જ રીતે એક રિવાયતમાં આવે છે કે એક કવિ કાબાલ જિન ઝાલીર હતો જે મુસ્લીમ સ્ત્રીઓ વિશે ખરાબ પંડિતાઓ કરતો હતો. તેમની પવિત્રતા પર હુમલો કરતો હતો. તેની પણ સજાનો હુકમ જરી થઈ ચુક્યો હતો જ્યારે મક્કા વિજય થયો તો કસબના ભાઈ એ તેને લખ્યું કે મક્કા વિજય થઈ ચુક્યો છે સારુ રહેશે કે તું રસૂલુલ્લાહ સ.અ.વ.થી માફી માંગી લો. જ્યારે તે તોબા કરીને મદીના આવી ગયો અને માફી માંગી તો આંહગરત સ.અ.વ. એ સહાનુભૂતિ ફરમાવતા તેને પણ માફ કરી દીધો પછી તેણે એક કસીદો પણ આંહગરત સ.અ.વ.ની સેવામાં પેશ કર્યું. આંહગરત સ.અ.વ. એ પોતાની એક સુંદર ચાદર ઈનામમાં તેને આપી દીધી, આમ, આ દુશ્મન જેની સજાનો હુકમ જરી થઈ ગયો હતો આપ સ.અ.વ.ના દરભારથી ન ફક્ત જીવનદાન લઈને ગયો બલ્કે ઈનામ લઈને પાછો વળ્યો તો આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ છે જે આપ સ.અ.વ.ના જીવનથી મળે છે જ્યારે આપે સુધારના હેતુ થી પોતાના દુશ્મનોને પણ માફ કર્યા. પોતાના સગાસંબધીઓના દુશ્મનોને પણ માફ કર્યા અને ઈસ્લામના દુશ્મનોને પણ માફ કર્યા. પરંતુ જ્યાં સુધાર માટે સજાની જરૂર હતી તો સજા પણ આપે આપી. તો અસલ હેતુ આ ખાસ હુકમની અહેમીયતની દ્રષ્ટિથી એ છે કે તમારે સુધારણા કરવી છે ન કે બદલો લેવો છે.

હગરત મસીહ મોઉદ (અ) એ સુરતે શૂરાની આ ૪૧મી આયતની પોતાની પુસ્તકો અને કથનોમાં અનેક સ્થાને વ્યાખ્યા કરી છે આપની લગભગ ૧૩ પુસ્તકોમાં હવાલાઓ જોવા મળે છે અથવા તેનાથી પણ વધારે હોય. અને તેમાં ૨૧, ૨૨ સ્થાને આ સંદર્ભમાં આપે વાત કરી છે તેવી જ રીતે પોતાની મજલિસમાં પણ અનેક સ્થાને એનું વર્ણન ફરમાવ્યું ઈસ્લામી શિક્ષણની વાસ્તવિકતામાં આપે સજા અને માફીની ફિલોસોફી અને રૂઢ બચાન કરતા ફરમાવ્યું કે બદીની સજા તે પ્રમાણે છે જેટલી કરવામાં આવી છે (આ આયતની રોશાનીમાં) પરંતુ જે વ્યક્તિ ગુનાહને માફ કરી દે અને એવા અવસર પર માફ કરે કે તેનાથી કોઈ સુધારણા થતી હોય. કોઈ ખરાલી પૈદા ન થતી હોય તો માફ કરનાર અલ્લાહતાલા પાસેથી બદલો મેળવશે ફરમાવ્યું કે આ આયતથી જહેર થાય છે કે કુરાન શરીફની તાલીમ એ નથી કે વગાર કારણે પ્રત્યેક અવસર પર ઉપદ્રવનો મુકાબલો ન કરવામાં આવે અમુકવાર ઉપદ્રવનો મુકાબલો કરવો પડે છે અને ઉપદ્રવિઓઓ તથા અત્યાચારીઓને સજા ન અપાય બલ્કે આ શિક્ષા છે કે જોવું જોઈએ કે તે અવસર ગુનાહ માફ કરવાનો છે કે સજા આપવાનો માટે આરોપી માટે તથા સામાન્ય જનતાના હકમાં જે વાસ્તવમાં ઉચિત હોય તે પ્રક્રિયા કરવામાં આવે. આજ કાલ માનવાધિકારોના ગંડાઓ લઈને જે

લોકો ફરે છે તે એક બાજુ જ ગુરું ગયા. કોઈનો કેટલો જ મોટો આરોપ હોય માનવ સહાનુભૂતિના નામે આરોપીઓને પણ એટલી છુટ આપવામાં આવે છે કે ઘણા બધા આરોપીઓ જે છે તેમને તેઓમાં આરોપોની અનુભૂતિ જ સમાસ થઈ ગઈ છે હત્યારા છે. પેશાવર હત્યારા છે અથવા ઘમંડ તથા અભિમાનમાં એટલા વધેલ છે કે તેમને પોતાના સિવાય જીજા કોઈના જીવનનો કોઈ મહત્વ દેખાતું નથી એવા લોકોની સજા તો હત્યા જ હોવી જોઈએ સિવાય તેમના કે જેની હત્યા થઈ હોય તેના અભિમાવક સ્વયં માફ કરી દે.

પછી હિન્દુ મસીહ મોઉદ (અ) એ ફરમાવ્યું કે ફક્ત એ જ ન જોવું કે આરોપી માટે શુ ઉચિત છે અમુકવાર એ જેવામાં આવે ફક્ત આરોપી નો જ દ્યાન નથી રાખવામાં આવતો કે સામાન્ય સમાજમાં શુ ઉચિત છે નાની વસ્તુને મોટી વસ્તુ માટે કુરબાન કરવું અથવા સમાજના વ્યાપક લાભને સામે રાખવું તે જરૂરી થઈ જાય છે ઘણી વખત. માટે કોઈ પણ સજાના નિર્ણય સમયે એ જેવું પણ જરૂરી છે કે સમાજ પર પણ સામૂહિક રૂપથી તેનો શું પ્રભાવ પડી રહો છે ઘણી વખત માફ કરી દેવું સમાજમાં અનુચિત પ્રભાવ ઉત્પદ્ધ કરે છે કે જુઓ કેટલો મોટો આરોપી એક કુકર્મ કરીને બચી ગયો તો અસામાજુક તત્ત્વ આ વિચારે છે કે અમે પણ કુકર્મ કરીને તથા માફી માંગીને બચી જઈશું એવી રિચિત્ર પછી આરોપીઓને કુકર્મ કરવા માટે પ્રોત્સાહન આપે છે જો માફી આરોપીઓને નિર્ભય કરી રહી છે તો પછી સજાની જરૂર છે ન કે માફીની. હિન્દુ મસીહ મોઉદ (અ) એ એક અવસર પર ઈસ્લામની સુંદર તાલીમનો તોરેત અને ઈન્જુલથી તુલના કરતા ફરમાવ્યું કે ઈન્જુલમાં લખ્યું છે કે તુ બદીનો મુકાબલો ન કર અથર્તા ઈન્જુલની શિક્ષા વર્તું તરફ ગુરુકેલ છે તથા વિશેષ પરિસ્થિતિઓને અધીન મળુંય તેના અનુસાર કાર્ય કરી જ નથી શકતો બીજુ તરફ તોરેતની શિક્ષા જોઈએ તો તે ન્યૂનતા તરફ ગુરુકેલ છે અને તેમાં પણ માત્ર એક જ વાત તરફ જોર આપવામાં આવે છે કે જીવના બદલે જીવ, અંખના બદલે આંખ અને કાનના બદલે કાન અને દાંતના બદલે દાંત તોડવામાં આવે તેમાં માફી તથા દરગુંગરનો નામ પણ નથી લેવાયું પરંતુ કુરાને શરીફમાં આપણને કેટલો પવિત્ર માર્ગ બતાવ્યો છે જે ઓછુંબનું માનવ પ્રકૃતિ અનુસાર છે. દા.ત. કુરાને શરીફમાં ફરમાવ્યું છે કે ઈજાનો બદલો ઈજા પુરતો જ લેવામાં આવે અથર્તા એટલી જ સજા આપવી ઉચિત છે પરંતુ જો કોઈ માફ કરી દે અને આ માફીમાં સુધાર સંમૂખ હોય અકારણ તથા વિના અવસરે માફી ન હોય બલ્કે ઉચિત અવસર પર હોય તો એ રીતે માફ કરવાથી તેના માટે ભલો બદલો છે જે તેને ખુદા પાસેથી મળશે.

ઇસ્લામી શિક્ષાએ જ છે જે પ્રત્યેક યુગમાં દુનિયાની સમસ્યાઓનું નિવારણ છે ચાહે તે સજા માટે હોય અથવા અન્ય સમસ્યા હોય, હિન્દુ મસીહ મોઉદ (અ) ફરમાવે છે કે એક વર્ગ તો તે છે જે માફ કરવું જાણતો જ નથી. અને ખાનદાની દુશ્મની પણ ચાદ રાખે છે તથા બીજુ બાજુ એવા નિર્લજ્જત તથા પિશાચ લોકો છે તથા નેક ચલન પર એક પ્રકારનો ઘટલો છે માફીના નામે નિર્લજ્જતા દેખાડે છે માટે નિર્લજ્જતા પણ ન હોવી જોઈએ તથા અત્યાચાર પણ ન હોવું જોઈએ જો કોઈ કોઈની પુત્રી અથવા બહેનની ઈજ્જત પર આકમણ કરે છે પવિત્રતા પર પ્રહાર કરે છે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવી જોઈએ ત્યાં માફીનો પ્રશ્ન નથી માટે માફી તથા નિર્લજ્જતામાં અંતર પણ જાણવાની કૌશિશ કરવી જોઈએ. પરંતુ કાનૂન પોતાના હાથમાં ન લેવું આ હર હાલમાં શર્ત છે.

હિન્દુ મસીહ મોઉદ (અ) એ અનેક સ્થાનોએ આ વિશે સ્પષ્ટતા કરી છે આપના અમુક હવાલાઓ પૈશ કર છું. આ

હવાલાને જોવાથી એક જ વિષય એવું લાગે છે તે આંખો સામે આવી રહ્યો છે પરંતુ પ્રત્યેક સ્થાને આપે આ વિશે જે કઈ ફરમાવ્યું છે તેમાં અનેક રંગ તથા ઉપદેશ છે એક સ્થાને આપે ફરમાવ્યું કે બદીનો બદલો એટલો જ છે જેટલી બદી કરવામાં આવી છે પરંતુ જે વ્યક્તિત્વ માફ કરી દે તથા પાપીને ક્ષમા કરી દે તથા આ માફીથી કોઈ સુધાર થતો હોય ન કે કોઈ ભૂરાઈ તો ખુદા તેનાથી પ્રસંગ છે તથા તેને તેનો બદલો આપશે માટે કુરાનાન અનુસાર, ન પ્રત્યેક સ્થાને બદલો લેવા પ્રશંસનીય છે અને ન પ્રત્યેક અવસરે ક્ષમા પ્રશંસનીય છે જીલ્કે અવસરને ઓળખવો જોઈએ અને ઈચ્છાવું કે બદલો લેવું તથા ક્ષમા કરી દેવાની પ્રક્રિયા અવસર તથા અવસ્થાની પાલંડી સાથે હોય ન કે અકારણ એ જ કુરાનનો અર્થ છે.

માટે ફરમાવ્યું - ખુદા તે વ્યક્તિથી ખુશ થાય છે જેની ધારણા નેક છે તથા તેના કર્મ તથા કામોનો ઉદ્દેશ સુધાર છે પિશાચ વ્યક્તિત્વ માફ કરવાથી ખુદા ખુશ ન થશે ન તેનાથી ખુશ થાય છે જે પ્રતિશોધની ભાવના રાખે છે આ બંને વસ્તુ સામે હોવી જોઈએ ન એટલી નમૃતા હોય કે જિલ્કુલ નિર્લજ્જ થઈ જાય તેનાથી પણ અલ્લાહુતાલા ખુશ નથી થતો તથા ન એ હોય કે પ્રતિશોધની ધારણા હોય આ પણ અલ્લાહુતાલાને અપ્રસંગ કરે છે માટે બંને સીમાઓને સામે રાખીને ક્ષમા તથા સજના નિર્ણય લેવા જોઈએ આ વિષયમાં જમાઅતના પદાર્થિકારીઓ તથા નિગ્રામને પણ આ વાતનું દ્વારા રાખવું જોઈએ સામાન્ય રીતે દ્વારા રખાય છે અમુક લોકોની વિરુદ્ધ જે નિર્ણય થાય છે અથવા સિફારશ મને આવે છે હું એ તો નથી કહેતો કે પ્રતિશોધની ભાવનાથી આવે છે પરંતુ આ અવશ્ય અમુક વાર થયા છે કે સિફારશ કરનારનો ગુકાવ પ્રાકૃતિક રૂપથી સખ્ખતાઈ તરફ હોય છે તથા અમુક લોકો અત્યાર્થિક નમૃતા તથા ક્ષમાનો રજાહાન રાખે છે જેના કારણે પછી ખરાલીઓ પૈદા થાય છે માટે ન તો સજા આપવી સારી છે અને ન માફ કરવું પ્રશંસનીય છે વાસ્તવિક ભાવના અલ્લાહુતાલાની પ્રસંગતા પ્રાપ્તિ છે અને તે એ સમયે હાંસેલ થાય છે જ્યારે સુધારણા ઉદ્દેશ હોય તથા તેના માટે સંભંધિત વિભાગોને ઈચ્છાવું કે તે પ્રથાન કરે ચાહે તે અમૃતામા છે અથવા કગા છે કે ખુબ ઉંડાણમાં જઈને સિફારશ અને ફેંસલા કરવા જોઈએ જેથી તે વાસ્તવિક નિગ્રામ થી અવસ્થાઓ આપણે પોતાની અંદર પૈદા કરી શકીએ જે ખુદાતાલાની ખુશી હાંસેલ કરનાર બને અને તેના માટે ખુદાતાલાથી દુઆ તથા સહાયતા માંગવાની પણ જરૂર છે જ્યારે પણ કોઈ નિર્ણય થાય દુઆ સાથે થાય. પછી ખલિફાએ વકત પાસે સિફારશ થવી જોઈએ જેથી પ્રત્યેક પ્રકારના ખરાબ પ્રભાવથી તે વ્યક્તિત્વ પણ સુરક્ષિત રહે જેના વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવી રહી છે તથા નિગ્રામે ઈમાન પણ સુરક્ષિત રહે અને જમાઅતમા કોઈ પ્રકારનો ફેંસલો વ્યાકુળતાનું કારણ ન બને. તેવી જ રીતે એક બીજા સ્થાને પોતાની પુર્સ્તક નસીમે દાવતમાં હજરત મસીહ મોઉદ (અ) આ વિષયને જ્યાન કરતા દોષારોપણ કર્તા જે છે ઈસ્લામના. તથા તૌર મુસ્લીમોને ઈસ્લામની આ સુંદર તાલીમનું ઝાન હોવું જોઈએ આપે આ ખુબ વિસ્તારપૂર્વક જણાવ્યું કે આ એટલી સુંદર તાલીમ છે જે કોઈ અન્ય ધર્મમાં નથી ફરમાવ્યું કે જે કોઈ તમને દુઃખ પહોંચાડે દા.ત. દાંત તોડી દે, અથવા આંખ ફોડી દે તો તેની સજ એટલી જ છે જે તેણે કરી. પરંતુ જો તમે એવી અવસ્થામાં તેનો પાપ ક્ષમા કરી દો. જેથી આ ક્ષમાનો કોઈ નેક પરિણામ પૈદા થાય. તથા તેના દ્રાર સુધાર થઈ શકે અર્થાત દા.ત. આરોપી ભવિષ્યમાં આ કુકર્મ થી રોકાઈ જાય., (સુધારણા થાય) તો એવી પરિસ્થિતિમાં માફ કરવું જ ઉચિત છે તથા આ ક્ષમાશીલતાનો ખુદાથી બદલો મળશે.

જે રીતે પ્રકૃતિનો નિયમએ છે કે આપણું ભોજન પણ બદલાતો રહે છે અને ખાદ્ય સામગ્રી પણ અંતુ અનુસાર અલ્લાહુતાલાએ ઉત્પણે કરી છે તેવી જ રીતે ગર્મી શર્ડીની અંતુમાં કપડાની બદલી છે આ બધી વસ્તુ પ્રકૃતિના નિયમ અનુસાર છે ફરમાવ્યું તેવી જ રીતે નૈતિક હાલત પણ જરૂર પ્રમાણે બદલાવ ચાહે છે એક સમય ધાક બેસાડવાનો અવસર હોય છે ત્યાં નમૃતા તથા સહિષ્ણુતા દેખાડવાથી કામ બગાડ છે તથા લીજા સમયે નમૃતા તથા સહનશીલતા દેખાડવાનો અવસર હોય છે અને ત્યાં રોઅબ દેખાડવું હીત કાર્ય સમજાય છે અભિપ્રાય એ છે કે પ્રત્યેક અવસર તથા પ્રત્યેક અવસ્થા એક વાત ઈંછે છે માટે જે વ્યક્તિકું અવસરનો દ્યાન નથી રાખતો તે હૈવાન છે ન કે ઈંસાન અને જંગલી છે ન કે સાભ્ય.

પછી એક સ્થાને આપે ફરમાવ્યું કે કુરાન શરીફાએ કારણ વિના જ ક્ષમા તથા સહિષ્ણુતા ને ઉચિત નથી રાખ્યો. કેમકે તેના દ્રારા ઈંસાનના આચરણ બગાડ છે તથા સામાજિક વિકાસ ઉથલપાથલ થઈ જાય છે બલ્કે તે ક્ષમાની અનુમતિ આપી છે જેનાથી કોઈ સુધારણા થઈ શકે.

જે પ્રત્યેક વ્યક્તિકું પોતાની દૈનિક કાર્યોમાં તથા પરસ્પર સંબંધોમાં આત્મ નિરિક્ષણ કરે કે તે અન્ય લોકોના વિષયમાં શુભ ભાવના રાખે છે તથા પોતાના વિશે શુભ વિચારે છે તો તેના દ્રારા સમાજમાં એક સુંદરતા પૈદા થાય છે.

માટે મૂળ વસ્તુ એ જ છે કે દરેક સમયે આ ખ્યાલ રહે કે પ્રત્યેક કાર્ય અલ્લાહુતાલાની ખુશી હાંસેલ કરવા માટે હોય. જ્યારે આ થશે ત્યારે જ સુધાર થશે.

માટે આ બંને વાતોને આપણે હંમેશા ચાદ રાખવી જોઈએ તથા એટલા માટે સામે રાખવી જોઈએ કે સુધાર કરવું છે અને બૂરાઈએ ને રોકવું છે આપણે સમાજમા શાંતિ તથા સલામતિનું વાતાવરણ પૈદા કરવું છે અને સૌથી મોટું એ કે ખુદાતાલાને ખુશ કરવું છે કેમકે તે અત્યાયારીઓને પસંદ નથી કરતો અલ્લાહુતાલા આપણને કુરાનના આદેશો સમજાવવાની અને તેના પર અમલ કરવાની તોફિક આપે. આમીન....

Khulasa Khutba Jumma Huzoor Anwar 22th January 2016

BOOK POST (PRINTED MATTER)

To, _____

Ahmadiyya Muslim Community.

From : Office Masroor Manzil, Al-Aman Society, Narol, Ahmedabad-382405, Gujarat.

BOOK POST (PRINTED MATTER)

To,